

ચલણી નોટના બંડલને સ્ટેપલર ન કરવા  
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બેંક તથા લોકોને અપીલ કરે છે

25 ફેબ્રુઆરી, 2003

ધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચલણી નોટોના બંડલોમાં પીન લગાવવા પર મનાઈ હુકમ બેંકોને આપ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 35-એ મુજબ આ આદેશ લોકહિતને ધ્યાનમાં રાખી તેમને સારી, નુકસાન વિનાની નોટ આપવાના હેતુસર અપાયો છે.

ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવી નોટ સ્ટેપલર કર્યા વિના બેંકો તથા ગ્રાહકોને આપવાનું શરૂ કરી દીધું છે. જોકે એવું જોવા મળ્યું છે કે બેંક આ ચલણી નોટોને પીન લગાડી ગ્રાહકોને આપે છે. અગાઉ બેંક ચલણી નોટોના બંડલ પર એકથી વધુ જાડી પીન લગાડી ગ્રાહકોને આપતી હતી. જેને કારણે લોકોને તકલીફ પડતી. પીન દૂર કરવામાં ઘણીવાર હાથમાં વાગી જાય કે અને નોટ પણ ફાટી જતી હોય છે. માણસો તથા નોટને નુકસાન ન થાય તે માટે સ્ટેપલર ન કરવાનો નિર્ણય લેવાયો છે. સારી નોટ તેને કારણે ખરાબ થઈ જતી હોય છે.

ધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સરકારને પીન લગાડવાની ઘણી ફરિયાદો મળે છે. રિઝર્વ બેંકે હાથ ધરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે અન્ય કોઈ દેશમાં આવી પીન લગાડવાની પ્રથા નથી. 1998 થી રિઝર્વ બેંકે નોટના બંડલ પર પીન ન મારવાનું સૂચન બેંકોને આપતી આવી છે. નવેમ્બર 2002 માં પીન પર મનાઈ હુકમ બેંકોને ફરમાવવામાં આવ્યો.

રિઝર્વ બેંકના આ પગલાંને લોકોએ બહોળો આવકાર આપ્યો છે.

ધ રિઝર્વ બેંકની ઓફિસોમાં બેંકની શાખાઓમાંથી, સરકારી વિભાગોમાંથી, વગેરે જગ્યાએથી નોટ સ્વિકારવાની પ્રક્રિયા ફૂલી ઓટોમેટેડ પ્રોસેસિંગ મશીન દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસી વચ્ચે કલોજ સર્કિટ ટેલિવિઝન સાથે થાય છે.

અલ્પના કિલ્લાવાલા  
મહા પ્રબંધક

પ્રેસ રિલીઝ: 2002-2003/891